

અખબારી યાદી

અનુસૂચિત જનજાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓ માટે
ખડક ચઢાણ બેઝીકતાલીમ કોર્ષ
ફકત અનુ સૂચિત જનજાતિ યુવક-યુવતિઓ જ અરજી કરે.

રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ફકત અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓમાટે ખડક ચઢાણ બેઝીક કોર્ષની તાલીમનું આયોજન કરવાનું નકકી કર્યું છે.

તદ અનુસાર રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા જૂનાગઢ ખાતે ૧૦(દસ) દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ આગામી ઓક્ટોબર/૨૦૧૮માં પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

માત્ર અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન રૂમનં.૧, પ્રથમ માળ, સરદાર બાગ, જૂનાગઢને તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાની રહેશે.

તાલીમ કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળે આવવા-જવાનો પ્રવાસતેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

કોઇપણ બાબતની પૃચ્છા સબંધમાં જિલ્લા રમતગમત અધિકારી, જૂનાગઢને મોબાઇલ નંબર:-.9879463737 તેમજ E-mail dsojunagadhcity20@gmail.com ઉપર સંપર્ક કરવો

--સહી--

કમિશનર

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,

ગાંધીનગર.

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે અને

જિલ્લા રમતગમત અધિકારી આયોજીત

યોજનાનું નામ:-અનુસૂચિતજનજાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ યોજના

પ્રવેશપત્ર વર્ષ: ૨૦૧૮-૧૯

પ્રતિ,

જિલ્લા રમતગમત અધિકારીશ્રી,
બહુમાળી ભવન, રૂમનં.૧, ત્રીજો માળ,
સરદાર બાગ, જુનાગઢ-૩૬૨૦૦૧

ફોટોગ્રાફસ

ક્રમ	વિગત	માહિતી
(૧)	(૨)	(૩)
૧.	તાલીમાર્થીનું પૂરેપુરું નામ	
૨.	તાલીમાર્થીનું પૂરેપુરું સરનામું / ટેલીફોન નંબર / મોબાઇલ નંબર E-mail આઇડી સહીત	
૩.	તાલીમાર્થીની જન્મ તારીખ જેમની ઉંમર તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઇએ. (જન્મ તારીખના દાખલાની સ્વ પ્રમાણિત નકલ બિડવી)	
૪.	શિબિરાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછુ (ધોરણ-૧૦ પાસ)	New Ssc પાસ કર્યાનું વર્ષ..... કક્ષા..... ધોરણ-૧૨ પાસ કર્યાનું વર્ષ.....કક્ષા..... ગ્રેજ્યુશન પાસ કર્યાનું વર્ષ..... કક્ષા..... અન્ય
૫.	અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત નકલ.	
૬.	શિબિરાર્થીનો આધારકાર્ડ નંબર તથા આધારકાર્ડની નકલ જોડવી.	

(૧)	(૨)	(૩)
૭.	અગાઉ આ કચેરી દ્વારા આયોજીત ખડક	' હા ' કે ' ના '

	ચઢાણ બેઝીકતાલીમમાં ભાગ લીઢેલ છે ?	
૮.	તાલીમમાં ભાગ લીઢેલ હોયતો (અ) કયા વર્ષમાં (બ) કયા સ્થળે.....	
૯.	એન.સી.સી. કેડેટસ /એન.એસ.એસ. મેમ્બર / રાષ્ટ્રીય પરેડ-નવી દિલ્હી ૧૫ ઓગષ્ટ/૨૬ જાન્યુઆરી / તાલુકા /જિલ્લા /રાજ્ય / કક્ષાની માન્ય રમતોત્સવમાં ૧ થી ૩ નંબર વિજેતા / વિશિષ્ટ બહાદુરી/વીરતા/શૌર્ય માટેનો એવોર્ડ મેળવેલ હોય/પવર્તારોહણ બેઝીક તાલીમ લીઢેલ હોય અને કોઈ ખાસ અભિયાન કરેલ હોય દા.ત. સાયકલ રેલી,બાઇક રેલી કોઈ વિશિષ્ટ સામાજિક સેવા કાર્ય કરેલ હોય, તેવી વિગતો બાજુના કોલમમાં દર્શાવવી. કોલમ-૯માં દર્શાવેલ બાબતો ધરાવનારને તાલીમમાં અગ્રતા અપાશે. આ બાબતોનાં ભાગ લીઢાના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત નકલ મૂકવી.	
૧૦	તાલીમાર્થીના વાલીનો સંમતિપત્ર (સંમતિ પત્ર બીડવુ) વાલીની સંમતિ પત્રની તારીખ.....	

ઉકત વિગતો સંપૂર્ણ સાચી અને સત્ય હોવાની ખાતરી આપુ છું. તેમજ આ તાલીમ સબંધમાં સરકારશ્રીના નિયમોનું પાલન કરવાની બાંધધરી આપુ છું.આ તાલીમમાં સ્વેચ્છાએ જોડાવા આ અરજી કરું છું.તાલીમ દરમ્યાન કોઈ ઇજા/જાનહાનિ માટે મારી અંગત જવાબદારી રહેશે. તાલીમ શિસ્તબધ્ધ લેવાની ખાત્રી આપુ છું.

સ્થળ:-.....

તાલીમાર્થીની સહી.....

તારીખ:-.....

તાલીમાર્થીનું પુરૂ નામ

वाली/माता/पितानी सही.....